



બહુજનહિતાય બહુજનસુખાય

રેસ્ટોરેન્ટ અને અન્ય આતિથ્ય સત્કાર જગ્યાએ
COVID-19 અટકાયત માટે માર્ગદર્શન

1. તમામ કન્ટેન્ટમેન્ટ / કલસ્ટરમાં રેસ્ટોરન્ટ બંધ રહેશે. ફક્ત કન્ટેન્ટમેન્ટ / કલસ્ટરની બહાર ખોલવાની મંજૂરી આપવામાં આવશે.
2. ૬૦- ૬૫ વર્ષ થી વધુ વયના વ્યક્તિઓ, કોમોર્બીડીટીઝ વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ, ૧૦ વર્ષ થી નીચેના બાળકોને ઘરે રહેવા સલાહ આપવામાં આવે છે. રેસ્ટોરન્ટ પાણતે અંગે જરૂરી સલાહ સૂચનો આપવા વ્યવસ્થા કરવાની રહેશે.
3. **COVID-19** અંતર્ગત કેટલાક જરૂરી સૂચનો દરેક સ્ટાફ તેમજ પાલન કરાવાના રહેશે
 - બે વ્યક્તિઓ વચ્ચે ઓછામાં ઓછું ૬ ફૂટ નું અંતર રાખવાનું રહેશે
 - ફરજિયાત માસ્ક/ ફેસ કવર નો ઉપયોગ કરવો.
 - ૪૦ થી ૬૦ સ્કેન્ડ સુધી હાથ ધોવા. આલ્કોહોલ બેઇઝ સેનેટાઇઝર નો ઉપયોગ કરવો.
 - ખાસી કે છીક ખાતી વખતે મોઢા ઉપર રૂમાલ કે ટીસ્યુ રાખવું તેમજ તરતજ તેને ડીઝપોઝ કરવું.
 - પોતાની આરોગ્ય ચકાસવું તેમજ માંદગી જણાય તો હેલ્પલાઇન નંબર પર કોલ કરવો / હેલ્થ સેન્ટર વિગેરેનો સંપર્ક કરવો.
 - જાહેરમાં થુકવું નહિ.
 - દરેક ગ્રાહક / સ્ટાફ પાસે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવવી.
4. રેસ્ટોરન્ટે નીચે મુજબનું આયોજન કરવાનું રહેશે.
 - ડાઇન-ઇન ને બદલે ટેક અવે(પાર્સલ) સુવિધાને મહત્વ આપવાનું રહેશે. ડીલીવરી બોયએ ગ્રાહકને સીધા પેકેટ આપવાને બદલે દરવાજા પર મુકવાનું હિતાવહ રહેશે.
 - હોમ ડીલીવરીના દરેક સ્ટાફને થર્મલ સ્કેનરથી સ્કેન કરવાના રહેશે
 - એન્ટ્રન્સ પર સેનેટાઇઝર અને થર્મલ સ્કેનર ફરજિયાત મુકવાના રહેશે.
 - ફક્ત સિમટમ્સ નહિ ધરાવતા કર્મચારીઓ/ માલિકો ને પરવાનગી આપવી.
 - તમામ કર્મચારી/માલિકોએ હોટલની અંદર ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે.
 - પોસ્ટર્સ/સ્ટેન્ડીઝ/ઓડિયો-વિઝીયલ માધ્યમથી **COVID-19**ની સલામતી અંગેના ઉપાયો દર્શાવવાના રહેશે
 - સોશયલ – ડિસ્ટનસિંગ ફરિજિયાત પાલન કરાવવાનું રહેશે.
 - મોટી ઉમરના કર્મચારી, ગર્ભવતી મહિલાઓ તેમજ મેડીકલ કંડીશનમાં હોય તેવા કર્મચારીને પબ્લિક સીધા સંપર્કમાં ન આવવા દેવા, શક્ય હોય વર્ક ફ્રોમ હોમ કલ્ચર આપનાવું.

- પબ્લિક પાર્કિંગ પ્લેસ અને વધુ વ્યક્તિઓ ભેગા થતા હોય, ત્યાં સોશ્યલ - ડિસ્ટનસિંગનું ફરિજયાત પાલન કરવું.
- જો પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ હોય તેવા કિસ્સામાં ઓપરેટીંગ સ્ટાફે ફરિજયાત માસ્ક પહેરવું.ગાડીઓના ડોર હેન્ડલ ચાવીઓને ડીસ ઈનફેક્ટ કરવું.
- લાઈનમાં ઉભી રહેતી વખતે બે વ્યક્તિઓ વચ્ચે ઓછામાં ઓછુ ૬ ફૂટનું અંતર રાખવાનું રહેશે.
- સ્ટાફ અને ગૂડસ સપ્લાય માટે અલગ-અલગ એન્ટ્રી-એક્ઝીટની વ્યવસ્થા કરવી.
- માલસામાનની હેરફેર વખતે કાળજી રાખવી અને વારંવાર ડીસઈનફેક્ટ કરવું.
- રેસ્ટોરોન્ટમાં સીટીંગ કેપેસિટીના ૫૦% જ બેસાડી શકાશે અને જેમાં સોશ્યલ- ડિસ્ટનસિંગ ફરિજયાત પાલન કરવાનું રહેશે.
- ડિસ્પોઝેબલ મેનુ નો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે.
- કાપડના નેપકીન ને બદલે ડીઝપોઝેબલ નેપકીન વાપરવા વધુ હિતાવહ રહેશે.
- બુફે સર્વિસમાં સોશ્યલ - ડિસ્ટનસિંગ ફરિજયાત પાલન કરવાનું રહેશે.
- લીફ્ટમાં માણસની સંખ્યા મર્યાદિત રાખવા આયોજન કરવું.
- એસ્કેલેટર પર એક વ્યક્તિ છોડીને ઉભા રહે તે મુજબની વ્યવસ્થા કરવી.
- એરકંડીશનનું ટેમ્પરેચર ૨૪ થી ૩૦ સેલ્શીયસ રાખવું.
- મોટા મેળાવડા / વધુ લોકોને ભેગા થવું પ્રતિબંધિત છે.
- રેસ્ટોરેન્ટના બાથરૂમ, વોશિંગ સ્ટેશન અને પાણી પીવાની જગ્યાને વારંવાર સેનેટાઈઝ કરાવવી.
- ફેસ કવર / માસ્ક અને ઝાંઝાની ચકાસણી માલિકે કરવાની રહેશે.
- બાથરૂમની સફાઈ સમયાંતરે કરાવવાની રહેશે.
- ડીઝીટલ માધ્યમ ધ્વારા ચુકવણીનો આગ્રહ રાખવો.
- દરેક કસ્ટમર ગયા પછી ટેબલને સેનેટાઈઝ કરાવવું .
- રસોડામાં પણ સોશ્યલ - ડિસ્ટનસિંગ ધ્યાન રહે અને ફેસ માસ્ક અવશ્ય પહેરવા.
- ગેમિંગ આર્કેડ તેમજ બાળકોને રમવાની જગ્યા પર પ્રતિબંધ રહેશે.

- 5 જો કોઈ સંક્રાસ્પદ કે કન્ફોર્મ કેસ આવે તો.....
1. એ વ્યક્તિને અન્ય એક રૂમ માં આઈસોલેટ કરવી.
 2. ડોક્ટર તપાસ કરે ત્યાં સુધી ફેસ પર ફીરજીયાત માસ્ક પહેરી રાખવું.
 3. નજીકના ક્લીનિક કે હોસ્પિટલમાં તરતજ જાણ કરવી કે ડીસ્ટ્રીક હેલ્પ લાઈન ને જણાવવું.
 4. પબ્લિક હેલ્થ ઓથોરીટીએ જરૂરી કાર્યવાહી કરવી અને કોન્ટેક્ટ ટ્રેસીંગ ની કામગીરી કરવી.
 5. જો પોઝિટીવ કેસ મળે તો તરત જ પ્રીમાસીસ ને ડીસઇન્ફેક્ટ કરવું.

* * *